

ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૪૯૭ અને ૫૦૩ ની અરજી લગત હુકમ.

૧. અરજદાર પરેશભાઈ ભારમલભાઈ ચૌધરી ની અરજી વંચાણે લીધી. અરજદાર તથા વિ.એ.પી.પી.શ્રી ને સાંભળ્યા. રજુ દસ્તાવેજ ધ્યાને લીધા. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય ધ્યાને લીધો.
૨. અરજદારે તેઓની અરજીમાં રજુઆત કરેલ છે કે, તેઓ અરજીમાં જણાવેલ સરનામે રહે છે અને તેઓની સાથે સાઈબર ક્રાઈમનો બનાવ બનેલો અને તેઓના (૧) **HDFC Bank** ના ખાતા નં /ક્રેડીટ કાર્ડ . **50100553786905** માંથી રકમ રૂ. **7250/-** (૨) **State bank of india** ના ખાતા નં /ક્રેડીટ કાર્ડ . **39919849170** માંથી રકમ રૂ. **20850/-** તથા (૩) **The banaskantha District Central Co-Operative Bank Ltd.** ના ખાતા નં /ક્રેડીટ કાર્ડ . **118008712055** માંથી રકમ રૂ. **7500/-** કુલ રૂ. **35600/-** ઉપડી ગયેલા જેથી તેઓએ ૧૯૩૦ નંબર ઉપર ફરિયાદ નોંધાવેલી. જે ફરિયાદ નં. **31106250110648** થી નોંધાયેલી અને નીચેની વિગતે જણાવેલ સામાવાળા શંકાસ્પદ બેંકોમાં ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૬ મુજબ ફીઝ કરાવેલ જે આજ સુધી બેંકમાં જેમના તેમ પડી રહેલ અને પરત મળેલ નથી. આ બાબતે એફ.આઈ.આર. થયેલ નથી. તેઓને ખુબજ મોટું આર્થિક નુકશાન થયેલ હોય તથા તેઓને ગુજરાત ચલાવવા માટે સદર રૂપિયાની જરૂર હોય સદર નાણાં તેઓના ખાતામાં પરત અપાવવા માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૪૯૭ અને ૫૦૩ મુજબ યોગ્ય તે હુકમ થવા અરજ કરેલ છે.

2.A ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૬ મુજબ ફીઝ કરાવેલ રકમ અંગે શંકાસ્પદ બેંક ની વિગત:

ક્રમ	શંકાસ્પદ બેંક નું નામ	ખાતા નં.	રકમ રૂપિયા
1	Indian Overseas Bank	00031000019272	15633 /-

૩. અરજદારની અરજી સબબ તપાસ કરનાર અમલદાર એટલે કે પોલીસ અધિક્ષક, સાયબર ક્રાઈમ સેલ, સીઆઈડી ક્રાઈમ, પોલીસ ઈન્સ. ભાભરનાઓને સદર ગુના બાબતે તમામ પેપર સહિત સ્પષ્ટ અભિપ્રાય રજુ કરવા હુકમ કરવામાં આવેલ.
૪. જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક, સાયબર ક્રાઈમ સેલ, સીઆઈડી ક્રાઈમ, પોલીસ ઈન્સ. ભાભરનાઓએ તેઓનો અભિપ્રાય રજુ કરેલ છે. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તથા લગત કાગળો ધ્યાને લેતા તેઓએ સદરહુ ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ(પોલિસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી જેથી તે રૂપિયા

અરજદારશ્રીને પાછા આપવા તેઓનો અભિપ્રાય થાય છે.

5. સદર કામે અરજી સાથે રજુ કરવામાં આવેલ બેંક પેપર્સની નકલ ધ્યાને લેતા તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા રજુ કરવામાં આવેલ અભિપ્રાય તથા તેને લગત કાગળો ધ્યાને લેતા અરજદારના તેઓની અરજીમાં જણાવ્યા મુજબના નાણા ઉપડી ગયેલ હોવાનું તથા શંકાસ્પદ બેંકના ખાતા માં ટ્રાન્સફર થયાનું હાલના તબક્કે સ્પષ્ટ જણાઈ આવે છે. તદઉપરાંત રેકર્ડ પરની હકિકતો ધ્યાને લેતા હાલના કામે આજદિન સુધી કોઈ એફઆઈઆર થયેલ હોય કે હાલના કામે કોઈની ધરપકડ કરવામાં આવેલ હોય તેમ જણાઈ આવતું નથી તેમજ બનાવ બન્યો આટલો લાંબો સમય પસાર થયેલ હોવા છતાં આજદિન સુધી અરજદાર સિવાય અન્ય કોઈએ સદર નાણાની અત્રેની અદાલત સમક્ષ માંગણી કરતી કોઈ અરજી કરેલ નથી. તદઉપરાંત તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય ધ્યાને લેતા તેઓ સમક્ષ પણ કોઈએ આ નાણાની માંગણી કરેલ હોય તેમ જણાતું નથી. તેમજ તપાસ કરનાર અમલદાર દ્વારા સદર બેંક ખાતા બનાવટી હોવાનું જણાવેલું છે તથા સદરહુ ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ(પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી. જેથી તપાસ કરનાર અમલદાર દ્વારા સદર નાણા અરજદારશ્રીને પાછા આપવા સ્પષ્ટ અભિપ્રાય આપેલ છે. જેથી અત્રેની અદાલતના માનવા મુજબ હાલના અરજદાર સદર નાણાનો કબજો મેળવવા હક્કદાર હોવાનું જણાય છે.

6. આ તબક્કે સદર નાણા પરત આપવા બાબતે અત્રેની અદાલતની સત્તા હકુમત જોતા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ-૫૦૩ નીચે મુજબ જોગવાઈ કરવામાં આવેલ છે-

Section 503 in BNSS ACT, 2023

503. Procedure by police upon seizure of property.

(1) Whenever the seizure of property by any police officer is reported to a Magistrate under the provisions of this Sanhita, and such property is not produced before a Criminal Court during an inquiry or trial, the Magistrate may make such order as he thinks fit respecting the disposal of such property or the delivery of such property to the person entitled to the possession thereof, or if such person cannot be ascertained, respecting the custody and production of such property.

(2) If the person so entitled is known, the Magistrate may order the property to be delivered to him on such conditions (if any) as the Magistrate thinks fit and if such person is unknown, the Magistrate may detain it and shall, in such case, issue a proclamation specifying the articles of which such property consists, and requiring any person who may have a claim thereto, to appear before him and establish his claim within six months from the date of such proclamation.

7. આમ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૫૦૩ માં જણાવ્યા મુજબ જ્યારે કોઈપણ પોલીસ અધિકારી દ્વારા મિલકતની જમીની જાણ મેજિસ્ટ્રેટને કરવામાં આવે અને તપાસ દરમિયાન આવી મિલકત અદાલત સમક્ષ રજુ કરવામાં આવેલ ન હોય ત્યારે મેજિસ્ટ્રેટને આવી મિલકતના નિકાલ અથવા તો કબજા બાબતે યોગ્ય લાગે તેવો હુકમ કરવાની સત્તા આપવામાં આવેલ છે. મુદ્દામાલ

કરન્સી નોટ પરત કરવા અંગે નામ.ગુજરાત હાઇકોર્ટ તેમના ચુકાદો સ્પે.ફિ.એપ્લીકેશન નં.૭૧૦૮/૨૦૧૫, તા.૦૮.૧૨.૨૦૧૫ અભય શ્રેણીકભાઈ ગાંધી વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાતમાં સિધ્ધાંત પ્રસ્થાપિત કરેલ છે.

8. આમ, ઉપર ચર્ચા કર્યા મુજબ સદર કેસની તમામ હકિકત, સંજોગો તથા રજુ દસ્તાવેજો ધ્યાને લેતા સદર નાણા બેંકમાં જમા હોય તેથી સદર રોકડ રકમના દર તેમજ સીરીયલ નંબર બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેમજ ભવિષ્યે પણ મુદ્દામાલની ઓળખ બાબતની કોઈ તકરાર કે પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી. વધુમાં નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સુંદરભાઈ અંબાલાલ દેસાઈ વિરુદ્ધ ગુજરાત રાજ્ય, ૨૦૦૩(૧) જી.એલ.એચ.પાન નં.૩૦૭ ના ચૂકાદા માં પ્રસ્થાપિત સિધ્ધાંતો ધ્યાને લેતા પણ ઉપરોક્ત જણાવેલ કારણો સર હાલની અરજી મંજૂર કરવાપાત્ર જણાતી હોય ન્યાયના વિશાળ હિતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

હુકમ

૧. અરજદારની અરજી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ-૫૦૩ હેઠળ મંજૂર કરવામાં આવે છે.
૨. અરજદારને સદર ગુનાના કામે સીઝ કરવામાં આવેલ ઉપરોક્ત પેરા નં.2.A ની વિગતની રકમ ની દોઢી રકમના જામીન(બોન્ડ) તથા તેટલી જ રકમના સધ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપ્યેથી આ કેસના આખરી નિકાલ સુધી નીચેની શરતોએ વચગાળાની કસ્ટડી સ્વરુપે પરત સોંપવાનો હુકમ કરવામાં આવે છે.
૩. વધુમાં હુકમ કરવામાં આવે છે કે, અરજદાર દ્વારા હુકમ મુજબના જાતજામીન (બોન્ડ) તથા સધ્ધરજામીન પોલીસ સ્ટેશનમાં આપ્યેથી પોલીસ અધિકારી દ્વારા તે મતલબની જાણ તથા સદર હુકમની જાણ જે તે બેંકને કરવી તેમજ પેરા નં.2.A ની વિગતે દર્શાવેલ શંકાસ્પદ બેંક ને હુકમ કરવામાં આવે છે કે, તેઓને પોલીસ અધિકારી દ્વારા અરજદારે હુકમ મુજબના જાતજામીન (બોન્ડ) તથા સધ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપેલ હોવાની તથા સદર હુકમ ની જાણ મળ્યેથી દિન-૧૦ માં તેઓની બેંકમાં ઉપરોક્ત પેરા નં.2.A ની વિગતની રકમ જમા છે તે રકમ **HDFC bank**ના ખાતાનં.**50100553786905** માં જમા કરાવી તેની જાણ અત્રેની અદાલતને તથા લગત પોલીસ સ્ટેશનને કરવી.

શરતો:-

- (૧) અત્રેની અદાલત જ્યારે ફરમાવે ત્યારે અરજદારે આ નાણા અદાલત સમક્ષ રજુ કરવાના રહેશે.
- (૨) ઉપરોક્ત ખાતાધારક વ્યક્તિ કે અન્ય કોઈ વ્યક્તિ સદર નાણા પર કલેઈમ કરે અને પોતાનો દસ્ક/હિત પુરવાર કરે તેવા સંજોગોમાં અરજદારે સદર રકમ પરત કરવાની

રહેશે.

(૩) સદર મુદ્દામાલ રકમનો કોઈ ગુનાહિત કામે ઉપયોગ કરવો/કરાવવો નહીં.

(૪) કોઈપણ શરતનો ભંગ થયેથી હાલનો વચગાળાનો હુકમ આપોઆપ રદ ગણાશે તથા મુદ્દામાલ રોકડ રકમ ફરીથી જપ્ત થવાને પાત્ર રહેશે તથા બોન્ડ અને જામીનગીરીની રકમ પણ વસુલ કરવાને પાત્ર રહેશે.

હુકમ આજ રોજ ખુદી અદાલતમાં વાંચી સંભળાવી, સહી કરી જાહેર કર્યો.

તારીખ : ૦૬/૦૬/૨૦૨૬ .

ભાભર.

(એ.કે.સોમાણી)

જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ (ફ.ક.)

ભાભર (કોડ નં. જીજે૦૧૬૯૦)